

[6/A-9]
૮૫૫**SARDAR PATEL UNIVERSITY****B.Com (IV semester) Examination****10 April 2018 (Tuesday)****10:00 A.M. TO 12:00 P.M.****UBO4CCOM20- Fundamentals of Management Accounting****Total Marks: 60**

નોંધ: જમણી બાજુના આંકડા માર્ક્સ દર્શાવે છે

પ્રશ્ન:૧ (અ) સંચાલકીય હિસાબી પદ્ધતિનો અર્થ જણાવી, તેનું કાર્યક્ષેત્ર સમજાવો. (૧૦)

(બ) સંચાલકીય હિસાબનીશ ના કાર્યો જણાવો. (૫)

અથવા

પ્રશ્ન:૧ (અ) સંચાલકીય હિસાબી પદ્ધતિ અને નાણાંકીય હિસાબી પદ્ધતિ વચ્ચેનો તફાવત સમજાવો. (૧૦)

(બ) સંચાલકીય હિસાબી પદ્ધતિની મર્યાદાઓ જણાવો. (૫)

પ્રશ્ન:૨ નીચેની માહિતી પરથી દેવર્ષ કંપનીનું માર્ચ થી મે, ૨૦૧૭ માટે રોકડ અંદાજપત્ર તૈયાર કરો. (૧૫)

(અ) તા.૧-૩-૨૦૧૭ ના રોજ રોકડ અને બેંન્ક સિલક રૂ.૬૦,૦૦૦

(બ) પડતર પર કાચા નફાનો દર ૫૦%

(ક) અન્ય માહિતી;

માસ	ખરીદી રૂ.	શરૂનો સ્ટોક રૂ.	શિરોપરી ખર્ચા રૂ.
ફેબ્રુઆરી	૨,૪૦,૦૦૦	૨૦,૦૦૦	૪૦,૦૦૦
માર્ચ	૨,૮૦,૦૦૦	૩૦,૦૦૦	૫૦,૦૦૦
એપ્રિલ	૩,૨૦,૦૦૦	૫૦,૦૦૦	૬૦,૦૦૦
મે	૩,૬૦,૦૦૦	૬૦,૦૦૦	૭૦,૦૦૦
જૂન	૪,૦૦,૦૦૦	૫૫,૦૦૦	૮૦,૦૦૦

(ડ) ૬૦% ખરીદી અને વેચાણ શાખ પર થાય છે. રોકડ ખરીદી અને રોકડ વેચાણ બંને પર રોકડવટાવ નો દર ૫% છે.

(ઈ) એપ્રિલ, ૨૦૧૭ માં એક નવું મશીન રૂ. ૨,૪૦,૦૦૦ માં ખરીદવાનું છે, જેની ચૂકવણી ડિલિવરી વખતે ૫૦% કરવાની છે અને બાકીની રકમ પછીના મહિનામાં કરવાની છે.

(ફ) એપ્રિલ, ૨૦૧૭ માં એક બીજું મશીન રૂ.૧,૦૦,૦૦૦ની કિંમતે હપ્તા પદ્ધતિથી ખરીદવાનું છે, કરાર વખતે ૨૦% રકમ ચૂકવવાની છે અને બાકીની રકમ ચાર સરખા માસિક હપ્તાઓમાં વાર્ષિક ૧૨% વ્યાજ સાથે ચૂકવવાની છે.

(ગ) સમયગાળો: ઉધાર વેચાણ ૧ માસ, ઉધાર ખરીદી ૧/૨ માસ, શિરોપરી ખર્ચા ૧/૪ માસ

(હ) કાચમી મિલકતો પરના માસિક ઘસારાના રૂ.૧૦,૦૦૦ નો સમાવેશ શિરોપરી ખર્ચામાં થયેલ છે.

અથવા

પ્રશ્ન:૨ મુફલ લિમિટેડની ઉત્પાદન શક્તિ ૧૦૦% ક્ષમતાએ ૨,૦૦૦ એકમોની છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ઉત્પાદન અને વેચાણ અંગેની વિગતો નીચે મુજબ છે, તે પરથી ૫૦%, ૭૫% અને ૧૦૦% ક્ષમતાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરી નફો શોધો. (૧૫)

વેચાણ (એકમ દીઠ વે.કિં. રૂ.૪૦૦) ૪,૦૦,૦૦૦

નફો; પડતરના ૩૩ $\frac{1}{3}$ %